



Utkarsh Small Finance Bank

Aapki Ummeed Ka Khaata

(A Scheduled Commercial Bank)

# TERM DEPOSIT FORM

FOR INDIVIDUAL & NON-INDIVIDUAL EXISTING CUSTOMER

(PLEASE FILL THE FORM IN BLOCK LETTERS ONLY)

FIELDS MARKED\* ARE MANDATORY.

Date :

दिनांक :

तारीख :

A/c. to be opened at:

खाता यहाँ खोला जाना चाहिए:

ખાતું પર ખોલવામાં આવશે:

Branch Name

शाखा का नाम

શાખાનું નામ

Branch

Code

शाखा कोड

શાખા કોડ

Sourcing

Branch Name\*

सोर्सिंग शाखा

का नाम\*

સોર્સિંગ શાખાનું નામ\*

Sourcing

Branch Code\*

सोर्सिंग शाखा

का कोड\*

સોર્સિંગ શાખા કોડ\*

Type of A/c\* :

खाते का प्रकार\* :

ખાતાનો પ્રકાર\* :

Single ☐

एकल

એકલ

Joint ☐

संयुक्त

સંયુક્ત

Fixed Deposit ☐

सावधि जमा

ફિક્સ ડિપોઝિટ

(मुदती थापण)

FD Plus ☐

(Non-callable)

एफडी प्लस

(नॉन-कॉल करने योग्य)

FD प्लस

(નોન-કોલેબલ)

TD Plus ☐

(Non-callable)

टीडी प्लस

(नॉन-कॉल करने योग्य)

TD प्लस

(નોન-કોલેબલ)

Tax Saver FD ☐

टैक्स सेवर एफडी

ટેક્સ સેવર FD

Recurring Deposit ☐

आवर्ती जमा

રિકરિંગ ડિપોઝિટ

Others ☐

अन्य

અન્ય

(pls. specify)

(कृपया निर्दिष्ट करें)

(કૃપા કરીને સ્પષ્ટ કરો)

A/c Sub-type\* :

खाता उप-प्रकार\* :

ખાતાના પેઠા પ્રકાર\* :

Normal ☐

सामान्य

સામાન્ય

Sr. Citizen ☐

वरिष्ठ नागरिक

વરિષ્ઠ નાગરિક

(To avail senior citizen rate of interest, ensure your DOB is updated in bank records.)

(सिस्टम नगरिक व्याज दर का लाभ उठाने के लिए, सुनिश्चित करें कि आपकी जन्म तिथि बैंक रिकॉर्ड में अपडेट की गई है।)

(વરિષ્ઠ નાગરિક વ્યાજ દર મેળવવા માટે, ખાતાની કરો કે તમારું જન્મ પમાણપત્ર બેંક રેકૉર્ડમાં અપડેટ થયેલ છે.)

Staff ☐

कर्मचारी

કર્મચારી

Bulk ☐

Shoek

જથ્થો

(Single Rupee term deposits of Rupees two crore and above)

(एक करोड़ रुपये और उससे अधिक की)

(અણ સ્વરૂપ નાણાંિક ઝમા)

(રૂપિયા બે કરોડ અને તેથી વધુ રૂપિયાની એકલ મુદતી થાપણો)

Scheme Code:

योजना कोड:

યોજનાનો કોડ:

## A) PERSONAL DETAILS\*

व्यक्तिगत विवरण\*

વૈયક્તિક વિગતો\*

Primary Holder

प्राथमिक धारक

પ્રાથમિક ધારક

TITLE (Mr./Ms./Dr.)

श्री/श्री/डॉ.

સંબોધન (શ્રી/સુશ્રી/ડૉ.)

FULL NAME (Please leave space between words)

पूरा नाम (कृपया शब्दों के बीच जगह छोड़ दें)

સંપૂર્ણ નામ (કૃપા કરીને શબ્દો વચ્ચે જગ્યા છોડો)

CIF ID

सीआईएफ आईडी

સીઆઈએફ આઈડી

Joint Holder 1

संयुक्त धारक 1

સંયુક્ત ધારક 1

TITLE (Mr./Ms./Dr.)

श्री/श्री/डॉ.

સંબોધન (શ્રી/સુશ્રી/ડૉ.)

FULL NAME (Please leave space between words)

पूरा नाम (कृपया शब्दों के बीच जगह छोड़ दें)

સંપૂર્ણ નામ (કૃપા કરીને શબ્દો વચ્ચે જગ્યા છોડો)

CIF ID

सीआईएफ आईडी

સીઆઈએફ આઈડી

Relationship with Primary Holder

प्राथमिक धारक के साथ संबंध

પ્રાથમિક ધારક સાથે સંબંધ

Joint Holder 2

संयुक्त धारक 2

સંયુક્ત ધારક 2

TITLE (Mr./Ms./Dr.)

श्री/श्री/डॉ.

સંબોધન (શ્રી/સુશ્રી/ડૉ.)

FULL NAME (Please leave space between words)

पूरा नाम (कृपया शब्दों के बीच जगह छोड़ दें)

સંપૂર્ણ નામ (કૃપા કરીને શબ્દો વચ્ચે જગ્યા છોડો)

CIF ID

सीआईएफ आईडी

સીઆઈએફ આઈડી

Relationship with Primary Holder

प्राथमिक धारक के साथ संबंध

પ્રાથમિક ધારક સાથે સંબંધ

Joint Holder 3

संयुक्त धारक 3

સંયુક્ત ધારક 3

TITLE (Mr./Ms./Dr.)

श्री/श्री/डॉ.

સંબોધન (શ્રી/સુશ્રી/ડૉ.)

FULL NAME (Please leave space between words)

पूरा नाम (कृपया शब्दों के बीच जगह छोड़ दें)

સંપૂર્ણ નામ (કૃપા કરીને શબ્દો વચ્ચે જગ્યા છોડો)

CIF ID

सीआईएफ आईडी

સીઆઈએફ આઈડી

Relationship with Primary Holder

प्राथमिक धारक के साथ संबंध

પ્રાથમિક ધારક સાથે સંબંધ

PAN Number

Only for primary applicant

पैन नंबर

केवल प्राथमिक आवेदक के लिए

PAN નંબર

માત્ર પ્રાથમિક અરજદાર માટે

Form 60

Only for primary applicant

फॉर्म 60

केवल प्राथमिक आवेदक के लिए

ફોર્મ 60

માત્ર પ્રાથમિક અરજદાર માટે

Yes ☐

हाँ

હા

No ☐

नहीं

ના

## B) MODE OF OPERATION\* :

(Please ✓ one)

Self ☐

स्वयं

સ્વયં

Either or survivor ☐

दोनों में से कोई या

उत्तरजीवी

અથવા અન્ય સહ-ખાતાધારક

Anyone or survivor ☐

कोई भी या उत्तरजीवी

कोईपण अथवा सह-खाताधारक

Jointly ☐

संयुक्त

સંયુક્ત રીતે

Karta (HUF) ☐

कर्ता (हिंदू

अविभक्त परिवार)

કર્તા (HUF)

Others ☐

अन्य

અન્ય

(pls. specify)

(कृपया निर्दिष्ट करें)

(કૃપા કરીને સ્પષ્ટ કરો)

સંચાલનની રીત\* :

(કૃપા કરીને એક પર ✓ કરો)

Minor operated by Guardian ☐

अभिभावक द्वारा संचालित अवयस्क

સગીર - અભિભાવક દ્વારા સંચાલિત

Minor self ☐

अवयस्क स्वयं

સગીર સ્વયં

## C) DEPOSIT/STANDING INSTRUCTIONS\* :

जमा/स्थायी अनुदेश\* :

થાપણ/અચમી સૂચનાઓ\* :

Deposit/Installment Amount (FD/RD):

जमा/किस्त राशि (एफडी/आरडी):

જમા/હપ્તાની રકમ (FD/RD):

RD SI Date:

आरडी एसआई

(Frequency of SI will be monthly)

(एसआई की आवृत्ति मासिक होगी)

(ડા નું આવૃત્તિ માસિક હશે)

RD SI

તારીખ:

Rate of Interest

ब्याज की दर:

વ્યાજ દર:

% Period: Months

% अवधि: महीने

% સમયગાળો: મહિના

Days

दिवस

દિવસ

(days should not be mentioned for RD)

(आरडी के लिए दिनों का उल्लेख नहीं किया जाना चाहिए)

(RD માટે દિવસોનો ઉલ્લેખ ન કરવો)

Amount (in words)

राशि (शब्दों में)

રકમ (શબ્દોમાં)

Auto renewal : ☐

(No auto renewal for

Recurring Deposits)

स्वतः नवीनीकरण:

(आवृत्ति जमा के लिए कोई

स्वतः नवीनीकरण नहीं)

ઓટોમેટિક રીન્યુઅલ:

(આવૃત્તિ જમા માટે કોઈ ઓટોમેટિક

રીન્યુઅલ નથી)

(If yes) Maturity Instruction: Renew Principal & Interest

(यदि हाँ) परिपक्वता निर्देश: मूलधन और ब्याज का नवीनीकरण करें

(જો હા) પરિપક્વતા નિર્દેશ: મૂલધન અને બ્યાજ નું નવીનીકરણ કરો

Renew Principal ☐

मूलधन नवीनीकृत करें

મૂલધન નવીનીકૃત કરો

Interest Payout: At Maturity

(No auto renewal for Recurring Deposits)

ब्याज भुगतान: परिपक्वता पर

(आवृत्ति जमा के लिए कोई स्वतः नवीकरण नहीं)

વ્યાજ ચૂકવણી: પરિપક્વતા પર

(આવૃત્તિ જમા માટે કોઈ ઓટોમેટિક રીન્યુઅલ નથી)

Monthly ☐

मासिक

માસિક

Quarterly ☐

त्रैमासिक

ત્રૈમાસિક

TDS Details: Deduct TDS ☐

टीडीएस विवरण: टीडीएस में कटौती

TDS વિગતો: TDS કપાત

(If No please submit the

TDS exemption document)

(यदि नहीं, तो कृपया टीडीएस छूट

दस्तावेज जमा करें)

(જો ના હોય તો કૃપા કરીને TDS

મુક્તિ દસ્તાવેજ જમા કરો)

Form 15G/15H ☐

फॉर्म 15जी/15एच

ફોર્મ 15G/15H

Income tax exemption letter ☐

आयकर छूट पत्र

આવકવેરા મુક્તિ પત્ર

Validity of exemption letter

छूट पत्र की वैधता

મુક્તિ પત્રની માન્યતા

Note: 1) Interest payment is subject to RBI guidelines from time to time. 2) Please refer the latest interest rate chart at the branch or visit [www.utkarsh.bank](http://www.utkarsh.bank). 3) Interest payment is subject to tax deduction at source.

નોટ: 1) વ્યાજ મુગ્તાન સમય-સમય પર આરબીઆઈ કે દિશાનિર્દેશ કે અધીન છે. 2) કૃપા શાખા મેં નવીનતમ વ્યાજ દર ટાંટ દેહેં જા [www.utkarsh.bank](http://www.utkarsh.bank) પર જાએં. 3) વ્યાજ મુગ્તાન સ્રોત પર કર કટોતી કે અધીન છે.

નોટ: 1) વ્યાજની ચૂકવણી સમય સમય પર રજૂ કરવામાં આવતી રજા નો માર્ગદર્શિકાને આધીન છે. 2) કૃપા કરીને શાખામાં વ્યાજ દરનો નવીનતમ ચાર્ટ જુઓ અથવા [www.utkarsh.bank](http://www.utkarsh.bank) પર જુઓ. 3) વ્યાજની ચૂકવણી સ્રોત પર કર કપાતને આધીન છે.

## D) INITIAL PAYMENT DETAILS\*

प्रारंभिक भुगतान विवरण\*

Amount\*

in case of Cash/NEFT/RTGS/Direct debit

राशि

कैश/एनईएफटी/आरटीजीएस/ प्रत्यक्ष डेबिट के मामले में

रक़म\*

रेक़्स/NEFT/RTGS/सीधे डेबिट/ना डिस्सामें

Cheque No.

in case of Cheque

चेक संख्या

चेक के मामले में

चेक नं.

चेकना डिस्सामें

Please Debit My Account No. 

\*USFB a/c in case of direct transfer/

कृपया मेरी खाता संख्या डेबिट करें।

\*प्रत्यक्ष अंतरण के मामले में यूएसएफबी खाता संख्या/

कृपा करीने मारा भाता नंबरमांथी डेबिट करो.

\*सीधे हस्तांतरण/ना डिस्सामें USFB अ/c/

Account No. & Name\*

\*other own bank a/c in case of NEFT/RTGS

खाता संख्या और नाम\*

\*एनईएफटी/आरटीजीएस के मामले में अन्य बैंकों में स्वयं के खाते

भाता नंबर अने नाम\*

\*NEFT/RTGS ना डिस्सामें पोलतनु अन्य बैंक अ/c/

RTGS/NEFT UTR No.\*

आरटीजीएस/एनईएफटी यूटीआर नंबर\*

RTGS/NEFT UTR नंबर\*

Date of Transaction\*

in case of Cash/NEFT/RTGS/Direct debit

लेन-देन की तारीख\*

कैश/एनईएफटी/आरटीजीएस/ प्रत्यक्ष डेबिट के मामले में

देवऽदेवऽनी तारीख\*

रेक़्स/NEFT/RTGS/सीधे डेबिट/ना डिस्सामें

Value Date  
मूल्यन दिनांक  
मुल्य तारीख

Applicant(s) Signature only for Direct Debit from own A/c  
केवल अपने स्वयं के खाते से प्रत्यक्ष डेबिट के लिए आवेदक (कों) के हस्ताक्षर  
मात्र पोताना भाता मांथी डायरेक्ट डेबिट मांटे अरजदार(रो)ना हस्ताक्षर

E) REPAYMENT DETAILS\* Please Credit FD/RD maturity in:

पुनर्भुगतान विवरण\* कृपया एफडी/आरडी परिपक्वता को इसमें क्रेडिट करें:

युक्तवर्षीनी विगतो\* कृपा करीने FD/RD परिपक्वता \_\_\_\_ मां डेडिट करो:

1. Account No.

(With USFB)

खाता सं.

(यूएसएफबी के साथ)

भाता नं.

(USFB मां)

3. Account with other bank: 

(copy of passbook/cancelled cheque should be enclosed)

अन्य बैंकों में खाता:

(पासबुक/रद्द चेक की प्रति संलग्न की जानी चाहिए)

अन्य बैंकमां भातु:

(पासबुक/रद्द करेल चेकनी नकल जोडवीं)

IFSC

आईएफएससी

आठयेइथेससी

Bank Name

बैंक का नाम

बैंक नंुं नाम

Branch Name

शाखा का नाम

शाखा नंुं नाम

2. Through DD

In case the maturity/ Interest payout opted through Demand Draft, it will be delivered to registered mailing address of primary holder.

यदि डिमांड ड्राफ्ट के माध्यम से परिपक्वता/व्याज भुगतान का विकल्प चुना जाता है, तो इसे प्राथमिक धारक के पंजीकृत पता पर दिया किया जाएगा।

डिमांड ड्राफ्ट द्वारा पाकती मुदत/अवधि युक्तवर्षीनी पसंदगीना डिस्सामें, ते प्राथमिक धारकना नोपावेला टपाल सरनामा पर पहुँचाइवामां आवशी.

डडी के माध्यम से DD द्वारा

Account Name

खाता नाम

भातानुं नाम

F) NOMINATION DETAILS (FORM DA1)\*

नामांकन विवरण (फॉर्म डीए 1)\*

नामांकननी विगतो (फ़ोर्म Da1)\*

Yes, I/We wish to nominate (as per detail below)

हां, मैं / हम नामांकित करना चाहते हैं (नीचे दिए गए विवरण के अनुसार)

हां, हुं/अमे नामांकन करवा छंथीअे छीअे (नीथेनी विगत मुजअ)

No, I/We have been explained about the benefits of the nomination facility. However, I would like to inform you that I do not wish to provide nomination for account.

नहीं, मुझे /हमें नामांकन सुविधा के लाभों के बारे में समझाया गया है।

तथापि, मैं आपको सूचित करना चाहूंगा कि मैं खाते के लिए नामांकन प्रदान नहीं करना चाहता हूँ।

ना, भुने/अभने नामांकन सुविधांना लावो विशे समजववामां आव्युं छे. जो डे, हुं तमने जस्राववा मांगु छुं डे भाता मांटे नामांकन आपवा मांटे मारी छंअ नथी.

(Nomination applicable for Individuals only and one Individual nominee is permitted.)

(नामांकन केवल व्यक्तियों के लिए लागू है और एक व्यक्तिगत नामित की अनुमति है।)

(मात्र व्यक्तिअे मांटे ज नामांकन लावु पडं छे अने तेने मांटे अेक व्यक्तिगत नामितनी भंजूरी छे.)

Nomination under Section 45 ZA of the Banking Regulation Act, 1949 and Rule 2(1) of the Banking Companies (Nomination) Rules 1985 in respect of bank deposits.

बैंक जमाराशियों के संबंध में बैंकिंग विनियमन अधिनियम, 1949 की धारा 45 जेडए और बैंकिंग कंपनी (नामांकन) नियम 1985 के नियम 2 (1) के तहत नामांकन।

बैंकिंग विनियमन अधिनियम, 1949 नी कलम 45 ZA अने बैंक थापस्रोना संदर्भमां बैंकिंग कंपनीज (नामांकन) नियमो 1985 ना नियम 2(1) हेडण नामांकन.

I / We (Name) \_\_\_\_\_ (Address) \_\_\_\_\_

nominate the following person to whom in the event of my / our / minor's death the amount of deposit in the above account, may be returned by UTKARSH SMALL FINANCE BANK.

मैं / हम (नाम) \_\_\_\_\_ (पता) \_\_\_\_\_

निम्नलिखित व्यक्ति को नामित करें जिसे मेरी / हमारी / अवयस्क की मृत्यु की स्थिति में उपर्युक्त खाते में जमा राशि, उत्कर्ष लघु वित्त बैंक द्वारा वापस की जा सकती है।

हुं / अमे (नाम) \_\_\_\_\_ (सरनाभुं) \_\_\_\_\_

नीथेना व्यक्तिनुं नामांकन करो डे जेने मारा/अमारा/सगीरना मृत्युना डिस्सामें उपरोक्त भातामां जमा रकम, उत्कर्ष स्मोल फ़ाइनान्स बैंक द्वारा परत करवामां आवशे.

Nominee Name \_\_\_\_\_

नामिती का नाम

नामितनुं नाम

Address : Please ☒ if same as primary applicant ☐

पता: कृपया ☒ करें यदि प्राथमिक आवेदक के समान है

सरनाभुं: कृपा करीने जो ते प्राथमिक अरजदार समान होय तो ☒ करो

If different from primary applicant \_\_\_\_\_

यदि प्राथमिक आवेदक से अलग है

जो ते प्राथमिक अरजदारथी अलग होय

Relationship with depositor, if any

जमाकर्ता के साथ संबंध, यदि कोई हो

थापस्रदार साथेनी संबंध, जो डोछ होय तो

Age   Years 

उम्र साल वर्ष

हुंमर

If nominee is a minor, his / her date of birth: 

यदि नामिती अवयस्क है, तो उसकी जन्म तिथि:

जो नामित व्यक्ति सगीर छे, तो तेनी/तेसीनी जन्म तारीख:

^ If the nominee is a minor on this date, I / We appoint (Name) \_\_\_\_\_, Relationship with the minor

and Address : \_\_\_\_\_

to receive the amount of the deposit on behalf of the nominee in the event of my / our / minor's death during the minority of the nominee.

^ यदि नामिती इस तारीख को अवयस्क है, तो मैं / हम नियुक्त करते हैं (नाम) \_\_\_\_\_, अवयस्क के साथ संबंध

और पता: \_\_\_\_\_

मेरी / हमारी / अवयस्कता के दौरान अवयस्क की मृत्यु की स्थिति में नामिती की ओर से जमा राशि प्राप्त करने के लिए।

^ जो नामित आ तारीखे सगीर होय, तो हुं/अमे निमणूक करीअे छीअे (नाम) \_\_\_\_\_, सगीर साथे संबंध

अने सरनाभुं: \_\_\_\_\_

नामित व्यक्तिनी सगीर वय दरमियान मारा/अमारा/सगीरना मृत्युनी धरनामां नामित व्यक्ति वती थापस्रनी रकम मेणववा मांटे.

|                                        |                 |                             |
|----------------------------------------|-----------------|-----------------------------|
| <b>Witness 2</b><br>गवाह 2<br>साक्षी 2 | Place _____     | Date _____                  |
|                                        | स्थान _____     | दिनांक _____<br>तारीख _____ |
| Name _____                             | Signature _____ |                             |
| नाम _____                              | हस्ताक्षर _____ |                             |
| नाम _____                              | हस्ताक्षर _____ |                             |
| Address/ पत्ता/ सरनामું _____          |                 |                             |

Applicable only if nominee is a minor. Every deposit is made in the name of a minor the nomination should be signed by a person duly empowered to act on behalf of the minor.

\* केवल तभी लागू होता है जब नामित व्यक्ति अवयस्क हो. \*\* जहाँ अवयस्क के नाम पर जमा किया जाता है, नामांकन को अवयस्क की ओर से कार्य करने के लिए कानूनी रूप से हक्दार व्यक्ति द्वारा हस्ताक्षर किया जाना चाहिए।

\* नोमिनी सजोर लेना होता है ज लघु पक्षों. \*\* जहाँ सजोरिना नामे डिपोजीट करवायाम आये है, नामांकन पर सजोर वती अवयस्की करवा माडे अवयस्क रीते हस्ताक्षर वती हस्ताक्षर करवा.

जहां जमा राशि अकेले रखी जाती है और जमा धारक की मृत्यु की स्थिति में नामिती द्वाारा परिपक्वता से पहले निकासी की आवश्यकता होती है। (i) मेरी मृत्यु की स्थिति में, जमा राशि के लिए नामिती यदि मेरे कानूनी उत्तराधिकारियों की सहमति के बिना, बैंक

સે નિકાસી અનુરોધ કરતા હૈ, તો વહ સમય સે પહલે ઉક્ત જમા રાશિ વાપસ લેને કા હકદાર હૈ. મૈં આગે પુષ્ટિ કરતા હૂં કિ નામિતી કો ંસી જમા રાશિ કી પ્રાપ્તિયોં કા ખુગતાન બૈંક કી દેયતા કે વૈધ નિર્વહન કા પ્રતિનિધિત્વ કરતા હૈ. (ii) કિ નામિતી મૂત્ત જમાકર્તાો કે કાનૂની ઉત્તરાધિકારિયોં કે ટ્રસ્ટી કે રૂપ મૈં બૈંક સે ખુગતાન પ્રાપ્ત કરેગા ંર ંસે ંસા ખુગતાન ંસ અધિકાર યા દાવે કો પ્રભાવિત નહીં કરેગા જો મેરે કાનૂની ઉત્તરાધિકારિયોં કે પાસ ંસ નામિતી કો ઁલિફ હો સકતા હૈં જિસે ખુગતાન કિયા ગયા હૈં

જ્યારે ંકેલ થાપણ રાખવામાં આવી હોય અને થાપણ ધારકના મૃત્યુના કિસ્સામાં નામિત વ્યક્તિને સમય પહેલા ઉપાડ કરવાની જરૂર પડે ત્યારે. (i) મારા મૃત્યુના કિસ્સામાં, મારા કાનૂની વારસદારોની સંમતિ લીધા વિના, જો થાપણ માટે નામિત વ્યક્તિ બેંકને વિનંતી કરે તો, તે/તેણી, સમય પહેલા ઉક્ત થાપણ ઉપાડવા માટે કહદાર છે. હું વધુમાં ખાતરી આપું છું કે નામિતને આવી થાપણની રકમની ચુકવણી એ બેંકની જવાબદારીના માન્ય કિસ્થાજનું પ્રતિનિધિત્વ કરે છે (ii) નામિત વ્યક્તિ મૃતક થાપણદારના કાયદેસરના વારસદારોના દ્રશ્ય તરીકે બેંક પાસેથી નાણાં મેળવશે અને તેને/તેણીને આવી ચુકવણી મારા કાનૂની વારસદારોના, નામિત વ્યક્તિસામેના હક્ક અથવા દાવાને અસર કરશે નહીં કે જેમને ચુકવણી કરવામાં આવી છે.

- h) All encashment or withdrawals of Term Deposit with repayment instruction as direct credit to the linked account can be executed at any Utkarsh Small Finance Bank branch.

લિંક્ડ ઁાતે મૈં પ્રત્યક્ષ ક્રેડિટ કે રૂપ મૈં પુનઃખુગતાન નિર્દેશ કે સાથ સાવધિ જમા કે સમી નકદીકરણ યા નિકાસી કિસી ખી ઉત્કર્ષ લઘુ વિત્ત બૈંક શાખા મૈં નિષ્પાદિત કી જા સકતી હૈં.

તમામ રોકડ અથવા મુદતી થાપણના ઉપાડનો અમલ, તેની પુનઃ ચુકવણીની સૂચના સાથે લિંક કરેલ ખાતામાં સીધી ક્રેડિટ તરીકે, ક્રોઈપણ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક શાખામાં કરી શકાય છે.

- i) An overdue term deposit or its portion may be renewed from the date of Maturity, provided the overdue period from the date of maturity till the date of renewal does not exceed 14 days. The rate of interest payable on the amount of the deposit so renewed shall be the appropriate rate of interest for the period of renewal as prevailing on the date of maturity. If the overdue period is more than 14 days and if the depositor places the entire amount of overdue deposit or at least the principal amount of deposit as a fresh term deposit, interest may be paid for the overdue period on the amount so placed as a fresh deposit at the rate decided by the Bank.

અતિદેય સાવધિ જમા યા ંસકે હિસેસે કો પરિપક્વતા કી તારીખ સે નવીનીકૃત્ત કિયા જા સકતા હૈ, બશર્તે પરિપક્વતા કી તારીખ સે નવીકરણ કી તારીખ તક અતિદેય અવધિ 14 દિનૈં સે અધિક ન હો. ંસ પ્રકાર નવીનીકૃત્ત જમા રાશિ પર દેય બ્યાજ કી દર પરિપક્વતા કી તારીખ કો પ્રવલિત નવીકરણ કી અવધિ કે લિપ બ્યાજ કી ઉપયુક્ત દર હોગી. યદિ અતિદેય અવધિ 14 દિનૈં સે અધિક હૈ ંર યદિ જમાકર્તા અતિદેય જમા કી પૂરી રાશિ યા કમ સે કમ જમા કી મૂલ રાશિ કો નહીં સાવધિ જમા કે રૂપ મૈં રલતા હૈ, તો બૈંક દ્વારા તય કી ગૈડ દર પર નહીં જમા કે રૂપ મૈં રલો ગૈડ રાશિ પર અતિદેય અવધિ કે લિપ બ્યાજ કા ખુગતાન કિયા જા સકતા હૈં

મુદતવીતી મુદતી થાપણ અથવા તેના અંશને પાકતી મુદતની તારીખથી રીન્યુ કરી શકાય છે, જો કે પાકતી મુદતની તારીખથી રીન્યુઅલની તારીખ સુધીની મુદતવિતી અવધિ 14 દિવસથી વધુ ન હોવી જોઈએ. આ રીતે રીન્યુ કરવામાં આવેલી ડિપોઝિટની રકમ પર ચક્રવવાપાત્ર વ્યાજનો દર, પાકતી મુદતની તારીખે પ્રવર્તતા રીન્યુઅલના સમયગાળા માટે યોગ્ય વ્યાજનો દર હશે. જો મુદતવીતી અવધિ 14 દિવસથી વધુ હોય અને જો થાપણદાર મુદતવીતી થાપણની સંપૂર્ણ રકમ અથવા કામ સે કામ થાપણનું મુદ્દલ નવી મુદતી થાપણ તરીકે મૂકે, આવી નવી થાપણ માટે તો મુદતવીતી અવધિ માટે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ દરે વ્યાજ ચુકવવામાં આવી શકે છે.

- j) The pre-mature withdrawal of deposit(s) will require consent and signature of all the depositor(s) irrespective of mode of operations (if all depositors are alive).

જમા (ં) કી સમય પૂર્વ નિકાસી કે લિપ સમી જમાકર્તાં કી સહમતિ ંર હસ્તાક્ષર (યદિ સમી જમાકર્તાં જીવિત હૈં) કી આવશ્યકતા હોગી, યાહે સંચાલન કા તરીકા કુલ ખી હો.

થાપણના સમય પહેલાના ઉપાડ માટે તમામ થાપણદારોની સંમતિ અને હસ્તાક્ષરની જરૂર પડશે, પછી ભલેને સંચાલનની પદ્ધતિ ક્રોઈપણ હોય (જો બધા થાપણદારો જીવિત હોય).

- k) I/we have been informed about the applicable penal interest rate for premature withdrawal.

મુજે સમય પૂર્વ નિકાસી કે લિપ લાગૂ દંડાત્મક બ્યાજ દર કે બારે મૈં સૂચિત કિયા ગયા હૈ.

મને/અમને સમય પહેલા ઉપાડ કરવા માટે લાગુ પડતા દંડના વ્યાજ દર વિશે જાણ કરવામાં આવી છે.

- l) Premature withdrawal of deposit will attract 1% Penalty i.e. 1% less than card rate as on the date of deposit, for the period for which deposit has remained with Bank or 1% less than the contracted rate whichever is lower.

જમા કી સમય પૂર્વ નિકાસી પર 1% જુર્માના લગેગા યાની જિસ અવધિ કે લિપ જમા બૈંક કે પાસ રહા હૈ ંસકે લિપ જમા કી તારીખ કો કાર્ડ દર સે 1% કમ, યા અનુબંધિત દર સે 1% કમ, જો ખી કમ હો.

થાપણના સમય પહેલાના ઉપાડ પર 1% દંડ લાગશે, અર્થતઃ, જે સમયગાળા માટે બેંકમાં થાપણ રહી છે તે માટે અથવા કરાર કરાયેલા દર કરતાં 1% ઓછો વ્યાજ દર - બેમાંથી જે ઓછું હોય તે દંડ તરીકે વસૂલવામાં આવશે.

- m) The calculation of interest is basis 365 days in a year for the deposit booked in a non-leap year and 366 days in a year for a deposit booked in a leap year.

બ્યાજ કા પરિકલન ંક ગૈર-લીપ વર્ષ મૈં બુક કિપ ગઁ જમા કે લિપ ંક વર્ષ મૈં 365 દિનૈં ંર લીપ વર્ષ મૈં બુક કિપ ગઁ જમા કે લિપ ંક વર્ષ મૈં 366 દિનૈં કે આધાર પર કિયા જાતા હૈ.

નોન-લીપ વર્ષમાં બુક કરવામાં આવેલી થાપણ માટે વર્ષમાં 365 દિવસ અને લીપ વર્ષમાં બુક કરવામાં આવેલી થાપણ માટે વર્ષમાં 366 દિવસના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

- n) Non-Callable FDs cannot be withdrawn before the maturity period. This means these deposits are completely locked and individuals or depositors do not have any authority to call or withdraw their FD investments before maturity.

ગૈર-પ્રતિદેય ંફડી કો પરિપક્વતા અવધિ સે પહલે વાપસ નહીં લિયા જા સકતા હૈ. ંસકા મતલબ હૈં કિ ંસે જમા પૂરી તરહ સે લૉક હૈં ંર વ્યક્તિયો ંથવા થાપણદારોને પાકતી મુદત પહેલા તેમના FD રોકાણને ઉપાડવાની અથવા પાછી ખેંચવાની ક્રોઈ સત્તા નથી. ંર બ્યાજ કે બિના 'સોત પર કર કટૌતી' (ટીડીંસ) શામિલ હૈં

નોન-કોલેબલ FD પાકતી મુદત પહેલા ઉપાડી શકાતી નથી. આનો અર્થ એ છે કે આ થાપણો સંપૂર્ણપણે લોક છે અને વ્યક્તિઓ અથવા થાપણદારોને પાકતી મુદત પહેલા તેમના FD રોકાણને ઉપાડવાની અથવા પાછી ખેંચવાની ક્રોઈ સત્તા નથી.

#### Tax deduction at source/સોત પર કર કટૌતી/સ્રોત પર ંર કપાત

- a) In case of renewed deposits, the new deposit amount consists of the original deposit amount plus interest less Tax Deducted at Source (TDS) if any, less compounding effect of TDS. For reinvestment deposit, the interest reinvested is post TDS recovery and hence the maturity amount for reinvestment deposits would vary to the extent of tax and compounding effect on tax for the period subsequent to deduction till maturity. If Deposit is opened under Monthly/Quarterly Interest Payment Mode, then the renewed deposit shall not comprise of the interest part.

નવીનીકૃત્ત જમારાશિયોં કે મામલે મૈં, મૂલ જમા રાશિ ંર સોત પર બ્યાજ શામિલ હોતા હૈં લેકિન ંસમૈં નહીં જમા રાશિ મૈં સોત પર કર કટૌતી (ટીડીંસ), યદિ કોઈ હો ંર સોત પર કર કટૌતી (ટીડીંસ) કે ચક્રવૃદ્ધિ પ્રભાવ કો શામિલ નહીં કિયા જાતા હૈ. પુનઃનિવેશ જમા કે લિપ, પુનઃનિવેશિત લિપ જાને વાલા બ્યાજ મૈં સે ટીડીંસ વસૂલી કો ઘટયા જાતા હૈ ંર ંસલિપ પુનઃનિવેશ જમાં કો લિપ પરિપક્વતા રાશિ કા પરિકલન પરિપક્વતા તક કટૌતી કે બાદ કી અવધિ કે લિપ કર ંર કર પર ચક્રવૃદ્ધિ પ્રભાવ કી સીમા કો ઘટાકર કિયા જાતા હૈ. યદિ જમા માસિક / ત્રૈમાસિક બ્યાજ ખુગતાન મોડ કે તહત ઁોલા જાતા હૈં, તો નવીનીકૃત્ત જમા મૈં બ્યાજ કા હિસસા શામિલ નહીં હોગા.

નવી થાપણના કિસ્સામાં, નવી થાપણની રકમમાં થાપણની મૂળ રકમ વત્તા વ્યાજ ઓછા સ્રોત પર કપાત (TDS) જો ક્રોઈ હોય તો, ઓછા લાગુ TDS ના ચક્રવૃદ્ધિ વ્યાજનો સમાવેશ થાય છે. પુનઃરોકાણની થાપણ માટે, TDS ની વસૂલી પછી છે પુનઃરોકાણ કરાયેલ વ્યાજ ગણવામાં આવે છે અને તેથી પુનઃરોકાણની થાપણી માટે પાકતી મુદતની રકમ વેરાની મર્યાદા અને પરિપક્વતા સુધી કપાત પછીના સમયગાળા માટે વેરા પરના ચક્રવૃદ્ધિ તરીકે લાગુ થાય છે. જો થાપણ માસિક/ત્રિમાસિક વ્યાજ ચુકવણી પદ્ધતિ હેઠળ ખોલવામાં આવી હોય, તો રીન્યુ કરવામાં આવેલી થાપણમાં વ્યાજનો અંશ શામેલ હોવો જોઈએ નહીં.

- b) No deduction of tax shall be made for taxable interest in the case of individual resident in India, if such individual furnishes to the Bank, a declaration in writing in the prescribed form 15G/15H (as applicable, with PAN CARD details) to the effect that the tax on his/ her estimated total income for the year in which such interest income is to be included in computing his/her total income will be NIL. TDS rates will be as applicable from time to time as per the Income Tax Act, 1961 and Income Tax rules (which are subject to change as per directives of Ministry of Finance, Govt. of India). If TDS is not to be deducted, please submit Income Tax Exemption letter along with this Form.

ભારત મૈં વ્યક્તિગત નિવાસી કે મામલે મૈં કર યોગ્ય બ્યાજ કે લિપ કર કી કોઈ કટૌતી નહીં કી જાણી, યદિ ંસા વ્યક્તિ બૈંક કો નિર્ધારિત ફોર્મ 15 જી /15 ંચ (જૈસા કિ લાગૂ હો, પૈન કાર્ડ વિવરણ કે સાથ) મૈં લિખિત મૈં ંક ઘોષણા પ્રસ્તુત કરતા હૈં કિ ંસ વર્ષ કે લિપ ંસકી અનુમાનિત કુલ ંચ પર કર શન્ય હોગા જિસમૈં ંસો બ્યાજ ંચ કો ંસકી કુલ ંચ કે પરિકલન મૈં શામિલ કિયા જાના હૈ. ટીડીંસ દરે ંચકર અધિનિયમ, 1961 ંર ંચકર નિયમૈં (જો વિત્ત મંત્રાલય, ભારત સરકાર કે નિર્દેશોં કે અનુસાર પરિવર્તન કે અપીલ હૈં) કે અનુસાર સમય-સમય પર લાગૂ હોંગો. યદિ ટીડીંસ નહીં કાટા જાના હૈ, તો કૃપયા ંસ ફોર્મ કે સાથ ંચકર ફૂટ પત્ર જમા કરો.

ભારતમાં નિવાસી વ્યક્તિના કિસ્સામાં કરપાત્ર વ્યાજ માટે કરની કપાત કરવામાં આવશે નહીં, જો આવી વ્યક્તિ, બેંકને નિયત ફોર્મ 15G/15H માં લેખિતમાં ઘોષણા (PAN કાર્ડની વિગતો સાથે, જો લાગુ પડે તો) આપે, કે જે વર્ષ માટે તેની/તેણીની કુલ આવકની ગણતરીમાં આવી વ્યાજની આવકનો સમાવેશ કરવામાં આવે તે વર્ષ માટેની નવી અંદાજિત કુલ આવક પરનો કર શન્ય હશે. આવકવેરા અધિનિયમ, 1961 અને આવકવેરા નિયમો (જે નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશો અનુસાર ફેરફારને પાત્ર છે) મુજબ સમય સમય પર TDS દરો લાગુ થશે. જો TDS કપાશે નહીં, તો ફૂપા કરીને આ ફોર્મ સાથે આવકવેરા મુક્તિ પત્ર જમા કરો.

- c) Form 15G/H is required to be submitted separately for each financial year.

પ્રત્યેક વિત્તીય વર્ષ કે લિપ ફોર્મ 15 જી / ંચ અલગ સે જમા કરના આવશ્યક હૈ.

દરેક નાણાકીય વર્ષ માટે ફોર્મ 15G/H અલગથી જમા કરવું જરૂરી છે.

- d) The Bank shall not be liable for any consequences or loss arising due to delay or non-submission of form 15G/15H.

બૈંક, ફોર્મ 15જી /15ંચ કે વિલંબ સે જમા હોય યા ગૈર-જમા હોને કે કારણ ઉત્પન્ન કિસી ખી પરિણામ યા હાનિ કે લિપ ઉત્તરદાયી નહીં હોગા.

ફોર્મ 15G/15H જમા કરવામાં વિલંબ થાય અથવા તે જમા ન કરવાને કારણે ઉદ્ભવતા ક્રોઈપણ પરિણામો અથવા નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં.

- e) As per section 139A(5A) of the income Tax Act, every person receiving any sum of income or amount from which tax has been deducted under the provision of income tax act shall provide his/her PAN number to the person responsible for deducting such tax. In case the PAN number is not provided to the Bank, the Bank shall not be liable for the non availability of the credit of tax deducted at source.

ંચકર અધિનિયમ કી ધારા 139 ં (5 ં) કે અનુસાર, ંચકર અધિનિયમ કે પ્રાવધાન કે તહત ંચ કી ંસો કોઈ ખી રાશિ જિસમૈં સે કર કાટા ગયા હૈ, પ્રાપ્ત કરને વાલે પ્રત્યેક વ્યક્તિ, ંસ તરહ કી કર કી કટૌતી કે લિપ જિન્મેદાર વ્યક્તિ કો ંપના પૈન નંબર પ્રદાન કરેગા. યદિ પૈન નંબર પ્રદાન નહીં કિયા જાતા હૈ તો બૈંક સ્રોત પર કાટે ગઁ કર કે ક્રેડિટ કા લાભ નહીં મિલને કે લિપ ઉત્તરદાયી નહીં હોગા .

આવકવેરા અધિનિયમની કલમ 139A(5A) મુજબ, આવકવેરા અધિનિયમની જોગવાઈ હેઠળ આવકની ક્રોઈપણ રકમ અથવા ંવેલી રકમ કે જેમાંથી કર કાપવામાં આવ્યો હોય તે મેળવનાર દરેક વ્યક્તિએ આવી કપાત માટે જવાબદાર વ્યક્તિને તેનો/તેણીનો પાન નંબર પ્રદાન કરવો. જો PAN નંબર આપવામાં આવ્યો ન હોય તો કર કપાત કરાયેલ સ્રોતની ક્રેડિટનો લાભ ન મળવા બદલ બેંક જવાબદાર રહેશે નહીં.

- f) PAN is required to be submitted to the Bank for Fixed deposit of ₹50,000/- or more.

₹50,000/- ંચ ંસસે અધિક કી સાવધિ જમા કે લિપ બૈંક કો પૈન જમા કરના આવશ્યક હૈ.

₹50,000/- અથવા વધુની મુદતી થાપણ માટે બેંકમાં PAN જમા કરવું જરૂરી છે.

- g) PAN is required to be submitted to the Bank at a time of Term Deposit of amount exceeding ₹50,000 or once and/or the aggregate Term Deposit amount (including accrued interest) in a financial year exceeds ₹5,00,000/- with the Bank. In case, the PAN number is not provided to the Bank, the Bank shall not be liable for the non-availability of credit of Tax deducted at source and non-issuance of TDS certificate

₹50,000/- સે અધિક કી સાવધિ જમા કે સમય યા ંક બાર ંર/યા કિસી વિત્તીય વર્ષ મૈં કુલ સાવધિ જમા રાશિ (અર્જિત બ્યાજ સહિત) બૈંક કે પાસ ₹5,00,000/- સે અધિક હો જાતી હૈ તો પૈન બૈંક મૈં જમા કરના આવશ્યક હૈ. યદિ બૈંક કો પૈન સંઘયા પ્રદાન નહીં કી જાતી હૈ, તો સ્રોત પર કાટે ગઁ કર કા ક્રેડિટ ગ્રાહક કો પ્રાપ્ત નહીં હોને ંર ટીડીંસ પ્રમાણ પત્ર જારી નહીં કિપ જાને કે લિપ બૈંક ઉત્તરદાયી નહીં હોગા.

₹50,000 થી વધુ રકમની મુદતી થાપણ લેતા સમયે અથવા ંક જ સમયે અને/અથવા નાણાકીય વર્ષમાં કુલ મુદતી થાપણની રકમ (ઉપાર્જિત વ્યાજ સહિત) ₹5,00,000/- કરતાં વધુ હોય ત્યારે બેંકમાં PAN જમા કરવું જરૂરી છે. જો બેંકને PAN નંબર આપવામાં આવ્યો ન હોય, તો કર કપાત કરાયેલ સ્રોતની ક્રેડિટનો લાભ ન મળવા બદલ બેંક જવાબદાર રહેશે નહીં.

- h) As per section 206 AA introduced by Finance (no.2) Act. 2009 w.e.f. 01.04.2010, every person who receive income on which TDS is deductible shall furnish his/her PAN falling which TDS shall be deducted as at the rate of 20% in case of domestic deposits "Please further note that the absence of PAN, form 15G/15H and other exemption certificate will be invalid even if submitted & penal TDS will be applicable."

વિત્ત (સં.2) અધિનિયમ, 2009 દ્વારા દિનાંક 01.04.2010 સે શુરુ કી ગઈ ધારા 206 ંચ કે અનુસાર, પ્રત્યેક વ્યક્તિ જો ંસો ંચ પ્રાપ્ત કરતા હૈં જિસ પર ટીડીંસ કટૌતી યોગ્ય હૈ, ંસે ંપના પૈન પ્રસ્તુત કરના હોગા, ંસા ન કરને પર ઘરેલૂ જમાં કો મામલે મૈં 20% કી દર સે ટીડીંસ કાટા જાણગા. કૃપયા ંગો ધ્યાન દેં કિ પૈન કી અનુપસ્થિતિ મૈં, ફોર્મ 15જી ંર ંન્ય ફૂટ પ્રમાણ પત્ર અમાન્ય હોંગે, ભલે હી વે જમા કિયા ગઁ હૈ ંર દંડાત્મક ટીડીંસ લાગૂ હોગા.

01.04.2010 થી અમલમાં ફાઇનાન્સ (નં.2) અધિનિયમ 2009 દ્વારા રજૂ કરાયેલ કલમ 206 AA મુજબ, દરેક વ્યક્તિ કે જે આવક મેળવે છે કે જેના પર TDS કપાત પાત્ર છે તે તેના/તેણીના PAN ફોર્મિટ રજૂ કરશે, જેના પર 20% ના દરે TDS કાપવામાં આવશે.

- સ્થાનિક થાપણોના કિસ્સામાં "કુપા કરીને એક નોંધ લો કે PAN જમા નહીં કરવાના કિસ્સામાં, ફોર્મ 15G/15H અને અન્ય મુક્તિ પ્રમાણપત્રજમા કરવામાં આવ્યા હોય ટીપી પણ તે અમાન્ય ગણાશે અને દંડનીય TDS લાગુ થશે."
- i) The above terms and conditions are subject to change as per regulatory guidelines issued from time to time.  
उपर्युक्त निबंधन और शर्तें समय-समय पर जारी विनियामक दिशानिर्देशों के अनुसार परिवर्तन के अधीन हैं।  
ઉપરોક્ત નિયમો અને શરતો સમય-સમય પર રજૂ કરવામાં આવતી નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર ફેરફારને પાત્ર છે.
- j) A new section 206AB introduced in the Finance Bill, 2021 w.e.f 01. 07.2021 for deduction of tax at source at higher rates i.e 20% (for interest on deposit where prevailing TDS rate is 10%) if an amount is paid or payable to the specified person who did not file the income tax return for respective year as mentioned in said section.  
01. 07.2021 से वित्त विधेयक, 2021 में एक नई धारा 206एबी पेश की गई है जिसके अनुसार यदि उक्त धारा में उल्लिखित संबंधित वर्ष के लिए आयकर रिटर्न दाखिल नहीं करने वाले निर्दिष्ट व्यक्ति को राशि का भुगतान किया जाता है या देय है तो उच्च दरों अर्थात 20% (जमा पर ब्याज के लिए जहां प्रचलित टीडीएस दर 10% है) पर स्रोत पर कर की कटौती की जाएगी।  
નાણાં વિધેયક 2021 માં 01.07.2021 થી અમલમાં મુકાયેલ નવી કલમ 206AB મુજબ, જો નિર્દેશિત વ્યક્તિને કોઈ રકમ ચૂકવવામાં આવે અથવા ચૂકવવાની હોય અને તે વ્યક્તિએ ઉપરોક્ત કલમમાં જણાવ્યા મુજબ સંબંધિત વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું ન હોય, તો સ્ત્રોત પર કપાત વેરો લેવા દરે - એટલે કે - 20% ના દરે (થાપણ પરના વ્યાજ માટે જ્યાં TDS દર 10% છે) ચૂકવવાનો રહેશે.
- k) The extant TDS law requires tax to be deducted in case the projected interest exceeds threshold limit (₹50,000/- for senior citizens and ₹40,000/- for others). This threshold limit is to be calculated at the time of payment/credit of interest. Subsequently, in case the total interest falls below the threshold limit due to premature withdrawal of one or more FDs, the TDS deducted on earlier occasions will not be refunded. The deposit holder can claim the credit for TDS while filing his/her income tax return.  
વર્તમાન ટીડીએસ કાનૂન મેં અનુમાનિત વ્યાજ સીમા (વરિષ્ઠ નાગરિકોં કે લિઅ ₹50,000/- ઓર અન્ય કે લિઅ ₹40,000/-) સે અધિક હોને કી સ્થિતિ મેં કર કટોતી કી આવશ્યકતા હોતી હૈ। ઇસ સીમા કી ગણના વ્યાજ કે ભુગતાન/ક્રેડિટ કે સમય કી જાની હોતી હૈ। ઇસકે બાદ, યદિ ઇક યા ઇક સે અધિક સાવધિ જમા કી સમય પૂર્વ નિકાસી કે કારણ કુલ વ્યાજ સીમા સે નીચે ચલા જાતા હૈ, તો પહેલે કે અવસરોં પર કાટા ગયા ટીડીએસ વાપસ નહીં કિયા જાઅગા। જમા ધારક અપના આયકર રિટર્ન દાખિલ કરતે સમય ટીડીએસ કે લિઅ ક્રેડિટ કા દાવા કર સકતા હૈ।  
પ્રવર્તમાન TDS કાયદામાં અનુમાનિત વ્યાજ શ્રેણી મર્યાદા (વરિષ્ઠ નાગરિકો માટે ₹50,000/- અને અન્ય લોકો માટે ₹40,000/-) કરતાં વધી જાય તો કર કપાત કરવો જરૂરી છે. આ શ્રેણી મર્યાદા વ્યાજની ચૂકવણી/ક્રેડિટ સમયે ગણવામાં આવે છે. ત્યારબાદ, જો એક અથવા વધુ FD ના સમય પહેલા ઉપાડને કારણે કુલ વ્યાજ શ્રેણી મર્યાદાથી નીચે આવે તો, અગાઉના પ્રસંગોએ કાપવામાં આવેલ TDS પરત કરવામાં આવશે નહીં. થાપણ ધારક તેની આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે TDS માટે ક્રેડિટનો દાવો કરી શકે છે.

Bank reserves the right to make any changes in terms and conditions mentioned & same will be updated in Banks website [www.utkarsh.bank](http://www.utkarsh.bank).

બેંક ડિવિઝન નિયમોં અંતર્ગત શર્તોં માં કોઈં શીં બદલાવ કરને કા અધિકાર સુરક્ષિત રહતા હૈં ઓર ઇસે બેંક કી વેબસાઇટ [www.utkarsh.bank](http://www.utkarsh.bank) મેં અપડેટ કિયા જાઅગા।  
બેંક ઉલ્લેખિત નિયમો અને શરતોમાં કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે અને તે બેંકની વેબસાઇટ [www.utkarsh.bank](http://www.utkarsh.bank) પર અપડેટ કરવામાં આવશે.

G) DECLARATION:/ઘોષણા/ઘોષણા:

I/We have read and understood the Terms and Conditions (mentioned overleaf) governing the opening of an account with UTKARSH SMALL FINANCE BANK and those relating to various services. I/We accept and agree to abide by the same, including those excluding/limiting the Bank's liability. I/We understand that the Bank may, at its absolute discretion, discontinue any of the services completely or partially after giving prior notice, I/We agree with the same.

मैं/हमने उत्कर्ष लघु वित्त बैंक में खाता खोलने और विभिन्न सेवाओं से संबंधित नियमों एवं शर्तों (पीछे की ओर उल्लेख किए गए) को पढ़ा और समझा है। मैं/ हम इन शर्तों, जिनमें बैंक की देयता से मुक्त करने वाली या बैंक की देयता को सीमित करने वाली शर्तें भी शामिल हैं, को स्वीकार करते हैं और इनका पालन करने के लिए सहमति व्यक्त करते हैं। मैं/हम समझते हैं कि बैंक अपने पूर्ण विवेकाधिकार पर पूर्व सूचना देने के बाद किसी भी सेवा को पूरी तरह या आंशिक रूप से बंद कर सकता है, हम इससे सहमति व्यक्त करते हैं।

મેં/અમે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખાતું ખોલાવવાના અને તેણી વિવિધ સેવાઓ સાથે સંબંધિત નિયમો અને શરતો (ઉલ્લેખિત ઓવરલીફ) વાંચી અને સમજી લીધી છે. હું/અમે સ્વીકારીએ છીએ અને તેનું પાલન કરવા માટે સંમત છીએ, જેમાં બેંકની જવાબદારી બાકાત/મર્યાદિત છે. હું/અમે સમજીએ છીએ કે બેંક, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, પૂર્વ સૂચના આપ્યા પછી કોઈપણ સેવાને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બંધ કરી શકે છે, હું/અમે તે માટે સંમત છીએ.

|                                                                                                                       |                                                                                                                        |                                                                                                                        |                                                                                                                          |
|-----------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------|
| <br>Signature/ હસ્તાક્ષર/ હસ્તાક્ષર 1 | <br>Signature/ હસ્તાક્ષર/ હસ્તાક્ષર 2 | <br>Signature/ હસ્તાક્ષર/ હસ્તાક્ષર 3 | <br>Signature/ હસ્તાક્ષર/ હસ્તાક્ષર 4 |
|-----------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------|

(Branch need to verify the Customer Signature, Mode of Operation & put Signature Verification Stamp above)  
(શાખા કો ગ્રાહક કે હસ્તાક્ષર, સંચાલન કે તરીકે કો સત્યાપિત કરને ઓર વર્હા હસ્તાક્ષર કરકે સત્યાપન મુદ્ર લગાને કી આવશ્યકતા હૈ)  
(શાખા દ્વારા ગ્રાહકના હસ્તાક્ષર, સંચાલન પદ્ધતિની પુષ્ટિ કરવી અને સ્ટેમ્પ ઉપર હસ્તાક્ષર કરવા આવશ્યક છે.)

DECLARATION BY THE BRANCH/શાખા દ્વારા ઘોષણા/શાખા દ્વારા ઘોષણા

I hereby certify that this account opening form is complete in all respects and relevant documents have been obtained and verified. The Account may please be set up in CBS.

मैं एतद्वारा द्वाारा प्रमाणित करता हूं कि इस खाते खोलने के फॉर्म में सभी आवश्यक जानकारी उपलब्ध है और प्रासंगिक दस्तावेज प्राप्त किए गए और सत्यापित किए गए हैं। कृपया सीबीएस में खाता बनाया जाए।  
હું આથી પ્રમાણિત કરું છું કે આ ખાતું ખોલવાનું ફોર્મ બધી રીતે પૂર્ણ છે અને તે માટેના સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત થયા છે અને ચકાસવામાં આવ્યા છે. મહેરબાની કરીને ખાતું CBS માં સેટઅપ કરી શકાય.

Lead Generator Code   
લીડ જનરેટર કોડ  
લીડ જનરેટર કોડ

Lead Converter Code   
लीड कनवर्टर कोड  
લીડ કનવર્ટર કોડ



Branch Head / Authorised Signatory  
શાખા પ્રમુખ/પ્રાધિકૃત હસ્તાક્ષરકર્તા  
શાખાના વડા / અધિકૃત હસ્તાક્ષરકર્તા

EIN \_\_\_\_\_  
ईआईएन  
EIN

Value Date :   
मूल्यन दिनांक: DDMMYY  
મુલ્ય તારીખ :

Branch Stamp  
શાખા કા સ્ટામ્પ  
શાખા સ્ટેમ્પ

CUSTOMER ACKNOWLEDGEMENT/ ગ્રાહક કી પાવતી/ ગ્રાહક સ્વીકૃતિ

Type of A/c\*: Single ☐ Joint ☐ Fixed Deposit ☐ FD Plus ☐ TD Plus ☐ Tax Saver FD ☐ RD ☐ Others ☐  
खाते का प्रकार\*: एकल ☐ संयुक्त ☐ | सवधि जमा ☐ (Non-callable) ☐ टैक्स सेवर एफडी ☐ आरडी ☐ अन्य ☐  
ખાતાનો પ્રકાર\*: એકલ ☐ સંયુક્ત ☐ | ફિક્સ્ડ ડિપોઝિટ ☐ (મુદતી થાપણ) ☐ (Non-callable) ☐ ટીડી પ્લસ ☐ ટેક્સ સેવર એફડી ☐ આરડી ☐ અન્ય ☐  
(પ્લસ સ્પેસિફાઈ કરવા નિર્દિષ્ટ કરો/કુપા કરીને સ્પષ્ટ કરો)

Ref No.   
સંદર્ભ સં. સંદર્ભ નં.  
Please quote this reference no. for any future communication  
કૃપયા પ્રતિબંધ કે કિસ્કી ઓ સંચાર કે લિઅ ઇસ સંદર્ભ સંદર્ભ કો ઉક્ત કરે  
કુપા કરીને નોંધ લેવો કે આ સંદર્ભ નં. કોઈપણ ભવિષ્ય સંચાર માટે છે

Date:   
दिनांक: DDMMYY  
તારીખ:

Nomination taken : Yes ☐ No ☐  
नामांकन लिया गया: हाँ ☐ नहीं ☐  
નામાંકન લેવામાં આવ્યું : હા ☐ ના ☐

Signature of Bank Official  
along with Branch Stamp  
શાખા સ્ટામ્પ કે સાથ બેંક  
અધિકારી કે હસ્તાક્ષર  
શાખા સ્ટેમ્પ સાથે બેંક  
અધિકારીના હસ્તાક્ષર